

વृद्धि अने विकाससंक्षी सीमाचिह्नां

श्री शुओनां तंदुरस्त उठेर माटे खोरक अने पाणीथी पडा वधु कठिक आवश्यक छ. अन्य वस्तुओमां, तेमने प्रेम, समज, मार्गदर्शन अने सुरक्षानी ज्ञर छ. तेऽने तेमनां विश्व अंगे जीवामां, कौशल्यनां विकास माटे, अने तेमनी हमेशा बदलापी जुरियातो साथे गोठवामां मद्द आटे तमारी ज्ञर छ.

तमारां बाणकनां विकासमां भृत्यपूर्ज लूभिका भजवानुं कार्य उत्तेजक, सबर, फणदी बनी शके छ. तमे बाणकना देखाव, वर्ताङ्क अने वाकीमां फेरफार लगभग रोज अनुभवाशे, अने जल्दी तेम संग्रह शक्षो के तमारां बाणकनो सङ्गण विकास भृद्दांशे आ प्रक्षियामां तमारी बागीदारी पर अवलंबे छ.

ज्यारे तमे तमारां बाणकनी वृद्धिनुं निशेकाण करो, त्यारे आ ध्यानमां राखो के बो बाणको क्यारेय सरजा नथी छोता. एक बाजु वृद्धिनां अमुक 'चोकक्स' तबक्का छाय छ, त्यां तमारुं बाणक अन्य बाणक करतां अलग झटप्पी विकास पामी शके छ. आ उपरांत, तमारुं बाणक एक दिशामां झटपी विकासपामी शके छ, परंतु अन्यमां अटव्युं झटपी नहीं छाय.

जो तमे भानता हो के, तमारुं बाणक कोइ चोकक्स विकासनी दिशामां मुखेकी अनुभवी रहुं छे तो, गभराशो नहीं. वहेलासर भद्यस्तीयी विकासने संबंधित घटां पडकरोमां सहाय मेणवी शकाय छे—बाणक शावानी वय सुधी पहोंचे ते पहेलां वृद्धि अने विकास माटे बाणकनी क्षमता वधारवा माटे आपवामां आवती आ सेवाओनी एक प्रशावी छ.

आ पुस्तिकामां आपवामां आवती जांकारी सघन मानी शकाय नहीं. आम छतां, जो के, कोइ अमुक वये तमारुं बाणक शुं करी शक्षो तेनी सामान्य मार्गदर्शिका तरीके ते उपयोगी सांजित थहर शके छ.

आ जांकारी सुरक्षित अने हाथे लागी शकाय तेवा स्थाने राखो, जेथी तमे सरणताशी तेनो उपयोग करी शके—कदाच स्केप्युकमां, बेली लुक अथवा ज्यां तमे परिवारनी माहिती राखो छो त्यां. जो तेमने कोइ प्रश्नो छाय तो, तमारां स्थानिक नवजात अने शिशु कार्यकमने जांक करो.

४मे—२ महिना

शारीरिक विकास

- सपाठी योज्यी करवा क्यारेक ज मायुं उचुं करे छ
- हाथोने संभत शीते बंध राखे छ

वाक्यी विकास

- गांगांगाट करे छ अने योसो पाडे छ
- कदकलनांद करे छ

सामाजिक विकास

- अतिशय उधे छ
- अतिशय रुद्दन करे छ
- अस्थिर उध अने आहार पद्धति होइ शके
- माता-पितानो यहेरो अथवा अवाजनां प्रतिभावमां शांत थहर जाय

२ महिना

शारीरिक विकास

- पेट पर सूता मायुं उचुं करे
- सरण छलन-चलन होय
- मुश्तिने आराम आपै, आंगणीओ खोवे
- पौढ पर होय त्यारे हाथ हलावे छे अने पग्यी लात मारे

वाक्यी विकास

- गांगांगाट करे अने खास करीने ज्यारे वात करवाआं आवे, त्यारे वधुने वधु कोगणा करे
- अलग अलग ज्यस्रीयातो माटे अलग अलग शीते रहे

सामाजिक विकास

- स्मित आपवानुं शरु करे छे, ताश अने उत्तेजना दशीवे
- परिचित अवाजे तरफ भों फेरवे छे
- हाथमां लेवामां आवे त्यारे चूप थहर जाय
- गलीपची (रमत) बां आनंद अनुभवे छे
- आहार खेती वजते टूको आंजनो संपर्क जागवी राखे
- पोताने शांत राखवा माटे अंगूठे अथवा आंगणी चूमी शके

४ महिना

शारीरिक विकास

- भंडपां चारे तरफ नजर फेरवी शके
- टेकी आपवामां आपै तो टव्वर बेसे
- पेटपी और तरफ फेरे
- रमक्कां मुश्ती पहोंचे
- वस्तुओ पक्के
- पग्नां पंज सुधी पहोंची तेमने भोंमां लावे
- जांकिता अवाजे तरफ ध्यान आपै
- लोकोने आंभथी अनुसरे

वाक्यी विकास

- घ्से, योसो पाडे, अने बब्डाट करे
- गांगांगाट करे अने आनंदथी कोगणा करे
- "उह्ह" अने "आह" बोवे

सामाजिक विकास

- पोतानां पग्नां पंजथी रमवानुं पसंद करे
- काणो अने सङ्केद सिवायनां रंगो जुझे
- पोताने उच्चकवानी अने पकडवानी ईच्छा धरावतु होय त्यारे धमपछाडा करे
- परिवारनां सभ्योमां झरक बतावी शके
- रमवा माटे हाथ अने पंज फेलावे
- हसे

७ महिना

शारीरिक विकास

- थोडा समय माटे जाते बेसे
- रमक्कां पक्के अने जाते खोरकनां टुकडा खाय
- पकडवामां आवे त्यारे उबुं रहे, थोडुक वजन पोतानां पगा पर ले
- वस्तुओ सुधी पहोंचे, तेमने एक हाथथी बीज हाथमां फेरवे
- दांत आपवानां शर्स थाय छे, जे उधमां खलेल पाडे शके छे

वाक्यी विकास

- स्वरनां अवाजोने ज्ञें
- अवाजनी नकल करे
- "ना" अने पोतानां नामने प्रतिभाव आपै
- वात शरु करवा माटे शारीरिक भाषानो उपयोग करे

सामाजिक विकास

- एक्कुं रमे
- युक्तिओ अने रमक्कां साथे लांबो समय रमे
- अन्य बाणको साथ आनंद अनुभवे
- अवाज प्रत्ये वधु प्रतिभाव आपै
- अजायाथी दूर रहे, परिचित संभाण याजनाराओ पासे वधु रहे

१० महिना

शारीरिक विकास

- विविध पद्धतिओथी घूटठीये चावे
- वस्तुओ पर घस्ताय
- वस्तुओ पर टग्नीने उबुं रही शके
- अंगूठा अने आंगणीओथी नानी वस्तुओ पक्के

वाक्यी विकास

- "ना", "बाय-बाय", "दादा" अने "मामा" खोवे
- ध्यान भेंचवा माटे अवाजनो उपयोग करे

सामाजिक विकास

- वधु स्पनिर्भर बने—पकडवा करतां ऐक्ला रमवामां वधारे रस दाखवे
- हाथ अने च्येहरानां हावभावनी नकल करे
- माता-पिताने शोधवा माटे घूटठीये चावे
- ज्यारे नामथी खोलाववामां आवे त्यारे घूटठीये चालीने तमारी पासे आवे
- "संताक्कडी" रमवानुं पसंद करे
- पुस्तको अने सामग्रीकोनां पानां फेरवे
- अवाजनी रमतो रमवनुं पसंद करे
- "बाय-बाय" कहेवा हाथ हलावे
- सामान्य दिशा सूचनो समजे छे

१२ महिना

शारीरिक विकास

- घूटठीये चाववाने बादवे पगा पहेणा राजी डगमगतुं चावे
- पोतानी जाते आंगणीयी खाय
- चमची वापरवानुं शर्स करी शके
- पलांथी वाणीने बेसे छे

वाक्यी विकास

- कोइ खास युक्तिओने खोलाववा "दादा" अने "मामा" नो उपयोग करी शके
- ३ थी 10 "साचा" शब्दोनो शब्दकोष होइ शके
- पोतानी शारीरिक खोलीमां हावभाव उभेरे

सामाजिक विकास

- समूह (श्रोतागां) ने पसंद करे
- केयोंज्स साथे लीटा करे
- रमतमां वधु विविधता होय
- वधारे गमती अने अनगमती बाबतो प्रदर्शित करे
- अरेसामां पोतानी साथे छिडती करे अने पप्पी करे
- दींगलीओ अने प्राइसीओनां पोचा रमक्कां साथे रमे
- पुस्तकोमां आपेली वस्तुओ तरफ अंगूठि निर्देश करे छे अने तेमने ओणज
- सामान्य सादा शब्दो अने वाक्यो जैवाके "पप्पा पासे आपो" समजे

१५ महिना

शारीरिक विकास

- एक्कुं उबुं रहे अने चावे
- जाते खावा माटे चमचीयोनो उपयोग करे
- चाववानी स्थितिमां वस्तुओ पक्के

वाक्यी विकास

- सादा शब्दो अने वाक्योनो उपयोग करे
- माता-पिता डारा खोलायेला केटलांक शब्दो खोवे

સામાજિક વિકાસ

- સંગ્રહ સંભળવાનું અને ધૂન પર નાચવાનું પસંદ કરે
- "ના" પાડે અને ખોરાકનો અસ્વોકાર કરે
- આજુ-બાજુ પ્રત્યે વધુ જાગૃત બને
- વધુ સ્વનિર્ણલ બને
- અપ્તિશય પ્રવૃત્તિશીલ હોય

18 મહિના

શારીરિક વિકાસ

- અકડ દોડે
- દાઢી રમતી વખતે આખા હાથનો ઉપયોગ કરે
- જાતે ખાય છે, ચમચીથી જેમે છે, કાંટો વાપરવાનો પ્રયત્ન કરે
- જૂતા, ટોપી, મોટાં, કાઢે
- જેંચવાનું, ફેકવાનું, દ્વાબવાનું, ડચકવાનું પસંદ કરે
- મદદ વિના પગથિયામાં ચડ-ઉત્તર કરે

વાકી વિકાસ

- વસ્તુઓનાં નામ ઓળખે
- વ્યક્તિગત નામોનો ઉપયોગ કરે

સામાજિક વિકાસ

- સંશોધનમાં આનંદ અનુભવે
- ઘક્કોવાર ખોરાકનો અસ્વોકાર કરે

24 મહિના

શારીરિક વિકાસ

- પોતાની જાતે વસ્ત્રો ઉત્તરે (મોટી વસ્તુઓ જેવી કે પાયજામા)
- વાત મારવાનું શરૂ કરે
- કંપ બરાબર પકડો
- વસ્તુઓ અલગ મૂકે છે અને ફરીથી તેમને સાથે મૂકે

વાકી વિકાસ

- વધુ સ્પષ્ટ બોલે
- "બેંબી" ભાષાને બદલે નાનાં વાક્યો બોલે
- જાત સાથે વાતો કરવાનું પસંદ કરે
- અન્ય દ્વારા બોલાયેલ શબ્દો ફરી બોલે
- શબ્દો અને પ્રક્રિયાઓને જોડો

સામાજિક વિકાસ

- આજુભાજુનાં વાતાવરણને ઓળખે
- ભર્મો અને પાખાને મદદ કરવામાં આનંદ અનુભવે
- રખ્યા બાદ સાફસુફી કરવામાં આનંદ અનુભવે
- અત્યંત પ્રવૃત્તિશીલ હોય
- સમયાંતરે સ્વભાવ ઊગતા ઘરાવી શકે
- શરીરનાં બોલાયેલા ભાગો તરફ અંગૂધિ નિર્દેશ કરી શકે

36 મહિના

શારીરિક વિકાસ

- હિંદુકા ખાય અને ચઢે
- સ્વણ પર ઝૂંદે
- ઉંઘુ ચાલે
- ટ્રાયસિકલને પૈડાં મારે

વાકી વિકાસ

- નાનાં વાક્યોમાં વાત કરે, બહુવચનનો ઉપયોગ કરે
- નાનાં ગીતો ગાય
- માતા-પિતા સિવાય અન્ય દ્વારા પણ ભાષા સમજી શકાય
- પોતાનું નામ બોલે
- વધુને વધુ "ના"નો ઉપયોગ કરે
- પોતાનો ડર અને અશગાર જાહેર કરે

સામાજિક વિકાસ

- જાતે ચમચી અને કાંટાથી સારી રીતે ખાય
- સ્ટોથી પીવે
- મોટાં મણકાં પરોવે
- જાતે સારી રીતે કપડાં પહેરે
- જીતિગત ભૂમિકાને ઓળખવાનું શરૂ કરે
- ઘરની બધારનાં વાતાવરણને ઓળખવાનું શરૂ કરે

માતા-પિતા માટે નુસ્ખાઓ

- ભાગકો ત્યારે વાત કરવાનું શીજે છે જ્યારે અન્યને સંબંધે છે. તમારાં ભાગક સાથે વાત કરો, ગીતો ગાવ, અને વાંચો.
- ભાગકોને શારીરિક સંપર્ક ગમે છે - તમારાં ભાગકને સ્પર્શ કરો, હલાયો, પકડો રાખો.
- ભાગકો તાજાને અનુભવી શકે છે. તમારાં ભાગકનાં રૂદ્ધ પ્રત્યે ડડપી અને મદું પ્રતિભાવ આપો. તમારાં ભાગક સાથે વાત કરતી વખતે અને તેની દ્વારાથીમાં અન્ય સાથે વાત કરતી વખતે સંયેદનશીલ બનો.
- પ્રકૃતિ, બધારનાં વાતાવરણ પ્રત્યે ભાગકોનાં રસને જાગૃત કરે છે. તમારાં ભાગક સાથે વારંવાર બધાર ચાલવાનું રાખો. તાજી હવા પણ મદદસ્પ છે.
- તમારાં ભાગકની વય અને વિકાસને અનુસ્પદ રમકડાં પૂરાં પાડો. મોબાઇલ, રંગીન જોખા, દ્વાબવાનાં/ જેંચવાનાં રમકડાં, મોટાં બ્લોક, મોટાં દડ અને સંગીતમય સાધનો એ તમામ સારાં વિચારો છે.
- ભાગકોને જરૂરની સાચયો. ભાગકો અને નાનાં શિશુને કયારેય જોરથી ન હલાવો!

મેરિલિન્ડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્યુકેશન

વિશેષ શિક્ષણ વિભાગ / વહેલાસરની મધ્યસ્થી સેવાઓ

મેરિલિન્ડ નવજાત અને શિશુ કાર્યક્રમ

200 West Baltimore Street, 9th Floor

Baltimore, MD 21201

ફોન: 410-767-0261

મફત ફોન: 1-800-535-0182

ફેક્સ: 410-333-2661

TDD: 410-333-0731

Robert L. Ehrlich, Jr.

ગવર્નર

મેરિલિન્ડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્યુકેશન

Edward L. Root, અધ્યક્ષ

Jo Ann T. Bell, ઉપાધ્યક્ષ

Philip S. Benzil

Dunbar Brooks

Calvin D. Disney

Clarence A. Hawkins

Walter S. Levin

Karabelle Pizzigati

Maria C. Torres-Queral

John L. Wisthoff

Christopher J. Caniglia

Nancy S. Grasnick

શાળાઓનાં રજ્ય અધીક્ષક

Carol Ann Baglin

શાળાઓનાં સહાયક રજ્ય અધીક્ષક, વિશેષ શિક્ષણ વિભાગ / વહેલાસરની મધ્યસ્થી સેવાઓ

મેરિલિન્ડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્યુકેશન રેજગારીને અસર કરતી બાબતોમાં અથવા કાર્યક્રમ પૂરા પાઠ્યાં વણી, રંગ, જીતિ, વધ્ય, રાખ્યોપતા, ધર્મ અને પંગુતાનાં આધારે બેનદબાપ કરતાં નથી. વિભાગીય નીતિ સંબંધિત પૂછપરછ માટે સમાજના આશાવસન અને અનુપાલન શાખાઓ કોન: 410-767-0246 ફેક્સ 410-333-8165, અથવા TDD 410-333-6442 પર સંપર્ક કરો. ♦ આ દસ્તાવેજ વિશેષ શિક્ષણ વિભાગ, IDEA, ભાગ સ્થો, ગ્રાન્ટ #H181A020124 દ્વારા ત્યાર અને રજૂ કરવામાં આય્યુ. આથવા અન્ય કોઈ દસ્તાવેજ વિશેષ શિક્ષણ વિભાગ અને પુનર્વસન સેવાઓની કચેરી દ્વારા ઇડ કરવામાં આય્યુ. અથીં રજૂ કરવામાં આય્યુ. આયેલ વિચારો કે એ જરૂરી નથી અને એ શેરે ગંગાવામાં આય્યે. જાણકારી કોપોરાઇટ મુક્ત છે. વાચકોને તેની નકલ કરવા અને વહેલાયા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ કપા કરુને વિશેષ શિક્ષણ વિભાગ વહેલાસરની મધ્યસ્થી સેવાઓ, મેરિલિન્ડ રજ્ય શિક્ષણ વિભાગને તનો શ્રેય આપો. ♦ વિલાંગતાપ્યકૃત અમેરિકન અવિનિયમ (ADA) સાથે મુસંગત આ દસ્તાવેજ વિનાંશી પૈકેજની ફોર્મેટમાં ઉપલબ્ધ છે. સંપર્ક કરો: વિશેષ શિક્ષણ વિભાગ, વહેલાસરની મધ્યસ્થી સેવાઓ, મેરિલિન્ડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્યુકેશન, ફોન: 410-767-0249, ફેક્સ: 410-333-8165, TDD 410-333-0731.

4/04

મેરિલિન્ડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એડ્યુકેશન

વૃદ્ધિ અને વિકાસલક્ષી સીમાચિહ્નો



જન્મથી ત્રણ વર્ષની વયનાં નાના બાળકોમાં વિકાસની માર્ગદર્શિકા